

૨૬૮ મા.મ.વિભાગનો તા. ૧૮-૧-૦૮નો પરિપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૦૮/૫/સ.

વિષય:- ઈ-ટેન્ડરીંગમાં ટેન્ડર ફી અંગેના ડ્રાફ્ટ/ ચેક સ્કેન કરી ઈ-ટેન્ડરીંગના અન્ય ડોક્યુમેન્ટ સાથે રજુ કરવા અને ટેન્ડર મોકલવા બાબત.

પરિપત્ર:-

માર્ગ અને મકાન વિભાગમાં હાલ રૂા.૫૦ લાખથી વધુ રકમના ટેન્ડરો ઈ-ટેન્ડર પદ્ધતિથી મેળવવામાં આવે છે. પ્રવર્તતી પદ્ધતિ મુજબ ટેન્ડર ફી તથા અર્નસ્ટ ડીપોઝીટ વિભાગીય કચેરીએ રૂબરૂ ચોક્કસ સમયમર્યાદામાં મેળવ્યા બાદ એજન્સીનાં ટેન્ડર ખોલવામાં આવે છે. આ પદ્ધતિમાં મળેલ ફરિયાદ ધ્યાનમાં લેતા ઈ-ટેન્ડર પદ્ધતિમાં નીચે મુજબ ફેરફાર કરવા નિર્ણય લેવામાં આવે છે. આ શરતનો સમાવેશ દરેક ટેન્ડર નોટીસ/ટેન્ડરનાં મુસદ્દામાં કરવાનો રહેશે.

"Demand Draft for E.M.D. & Tender fee shall be submitted in electronic format only through online (by scanning) while uploading the bid. This submission shall mean that E.M.D & tender fee are received for purpose of opening the bid. Accordingly offer of those shall be opened whose E.M.D. & tender Fee is received electronically. However for the purpose of realization of D.D., bidder shall send the D.D. in original through R.P.A.D so as to reach to Executive Engineer, Division _____ within 7 days from the last date of uploading. Penaltative action for not submitting D.D. in original to E.E. by bidder shall be initiated. D.D. for Exemption Certificate is not necessary. However Exemption Certificate shall have to be submitted electronically through online.

Any documents in supporting of tender bid shall be submitted in electronic format only through online(by scanning etc.) & hard copy will not be accepted separately."

" ટેન્ડર માટે બાનાની રકમ (ઈ.એમ.ડી) તથા ટેન્ડર ફી નાં ડીમાન્ડ ડ્રાફ્ટ ઓન લાઈન સ્કેન કરી ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં ટેન્ડર અપલોડ કરવાનું રહેશે. આ પ્રકારે રજુ થયેલ વિગતે બાનાની રકમ અને ટેન્ડર ફી મળેલ ગણવાની રહેશે અને તદ્દઅનુસાર ટેન્ડર ખોલવામાં આવશે તે અનુસાર ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં બાનાની રકમ અને ટેન્ડર ફી મળેલ હોય તેની જ ઓફર ખોલવામાં આવશે. ખરેખર ચુકવણા માટે ટેન્ડર ભરનારે ડીમાન્ડ ડ્રાફ્ટ અસલમાં રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.ને કાર્યપાલક ઈજનેરશ્રી,વિભાગ.....ને અપલોડીંગની છેલ્લી તારીખથી દિન-૭માં મળે તે અનુસાર રજુ કરવાના રહેશે. અસલમાં ડીમાન્ડ ડ્રાફ્ટ નહી મોકલનાર સામે શિક્ષાત્મક પગલા શરૂ કરવામાં આવશે. બાના મુક્તિ માટે ડીમાન્ડ ડ્રાફ્ટ જરૂરી બનશે નહીં. પરંતુ મુક્તિના પ્રમાણપત્ર ઈલેક્ટ્રોનિકલી ઓન લાઈન રજુ કરવાનું રહેશે.

ટેન્ડર બીડનાં માટે જરૂરી આધાર માટેના કોઈ પણ ડોક્યુમેન્ટ ઓન લાઈન ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં સ્કેન કરી મોકલવાનાં રહેશે અને હાર્ડકોપી અલાયદી રીતે સ્વીકારવામાં આવશે નહીં."

**૨૭૩ માર્ગ અને મકાન વિભાગ, પરિપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૦૮-૫-સ (પાર્ટ ફાઇલ)
તા. ૨૭-૧૧-૨૦૦૮**

વિષય :- ઈ-ટેન્ડરીંગ, ટેન્ડર ફી અને અન્ય ડોક્યુમેન્ટસ રજુ કરવા અંગે.

વંચાણે લીધો : તા.૧૮/૧/૦૮ નો પરિપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૦૮/૫/સ

પરિપત્ર :-

માર્ગ અને મકાન વિભાગમાં હાલમાં ટેન્ડરો ઈ-ટેન્ડર પદ્ધતિથી સ્વીકારવામાં આવે છે તે અન્વયે સમાન ક્રમાંકના તા.૧૮/૧/૦૮ ના પરિપત્રમાં ટેન્ડર ફી અને બાનાની રકમ જે તે કાર્યપાલક ઈજનેરને ખરેખર ચુકવવા માટે દિન-૭ માં અસલમાં રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી મોકલવાની તેમજ અસલમાં ડીમાન્ડ ડ્રાફ્ટ નહિ મોકલનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ હતી.

ઉપરોક્ત પરિપત્રમાં નીચે મુજબ અંશતઃ સુધારો કરી આ શરતનો સમાવેશ ટેન્ડર નોટિસ/ટેન્ડરના મુસદ્દામાં Through R.P.A.D. so as to reach to E.E. Division Within 7 days from the last date of uploading ને બદલે “ to SE at the time of tender opening or Send the same through R.P.A.D. so as to reach to E.E. Division Within 7 days from the last date of opening.” સુધારો કરવામાં આવે છે. તેમજ ખરેખર ટેન્ડરફી તેમજ બાનાની રકમ નિયત સમયમાં ઈજારદાર ન ભરે તો ઈજારદારની નોંધણી એક વર્ષ એબેયન્સમાં રાખવાની કાર્યવાહી કરી ઈ- ટેન્ડરીંગનો કોડ એક વર્ષ માટે રદ કરાશે.